

BAPS Shri Swaminarayan Mandir

LONDON




निःशुल्क प्रवेश

लंडननुं सीमायिलन (नजराणुं)
नेशनल ज्योग्राफीक



યુરોપના પ્રથમ પરંપરાગત હિંદૂ મંદિરમાં આપનું સ્વાગત છે

લંડન શહેરના હૃદયસ્થાને વસેલું બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર (નિસ્ડન મંદિર) પરંપરાગત હિંદૂ શૈલીની, હેરત પમાડે તેવી ક્વાકોતરણીનું બેનમૂન નમૂનો છે. ફક્ત અઢી વર્ષના ગાળામાં ૫૦૦૦ ટન ઈટાલિયન અને ભારતીય આરપહાણ તેમજ બલ્ગેરિયન લાઈમસ્ટોનમાંથી ભારતીય કારિગરો દ્વારા ક્વા મંડિત લંડનમાં આકાર પામ્યું છે. સને ૧૯૯૫માં ઉદ્ઘાટિત થયેલું આ મંદિર ભક્તિ, ઉપાસના અને પ્રાર્થનાનું કેંદ્ર બની દરવર્ષે પાંચ લાખથી વધુ ભાવિકોને આકર્ષે છે. પાપાણ પર કોતરાયેલી નાજુકતાનું સૌંદર્યદર્શન, પરંપરાગત હિંદૂ પ્રાર્થનાસભા દ્વારા પથરાતી શાંતિ સહુને ક્વાકો સુધી સ્થિર કરી દે છે. વળી, અહીં વિશ્વની પ્રાચીનતમ જીવંત સંસ્કૃતિ વિશે જાણી સહુ અભિભૂત થાય છે.



પ્રેરક: પ.પૂ. પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન પ્રમુખ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ભગવાન શ્રીસ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક વારસદાર છે. તેમની આગવી સૂઝ, દીર્ઘદૃષ્ટિ, પ્રેરણા અને પ્રચંડ પુરુષાર્થના પરિણામે જ આ મંદિર સાકાર થઈ શક્યું. આ મંદિર ભગવાન સ્વામિનારાયણને તેમના દ્વારા અર્પણ થયેલું ભક્તિઅર્થ છે.



લંડનના સાત આશ્ચર્યોમાંનું એક
Time Out City Guides

વિશ્વના સૌથી
આશ્ચર્યકારી
સ્થળોમાંનું એક
The World of Interiors



ભવ્ય હવેલી

મંદિરમાં પ્રવેશતાં જ હવેલીની ભવ્યતા આંખે ઊડીને વળગે છે. એક અને સાગના કાષ્ઠના સ્તંભો તથા કમાનો પરની ઝીણી કોતરણી મનને હરે છે. કાષ્ઠમાં કોતરાયેલા મોર એવા તો આબેહૂબ છે કે જાણે હમણાં જ કળા કરશે, હાથીઓ જાણે સુંઢ ઊંચકી આવકારશે, કમળો પર ભમરાઓ આવ્યા જ સમજો ! વળી, જમીન પર પથરાયેલ ચિત્તાકર્ષક રંગબેરંગી ગાલીચો તો એક જુદી જ ભાત ઉપસાવી નજર બાંધી લે છે. સાવસતા તો જુઓ – અહીં વપરાયેલ કાષ્ઠ માટે જ્યાં એક વૃક્ષનો ભોગ અપાયો છે ત્યાં તેની સામે ૧૦ નવા છોડ રોપવામાં આવ્યા છે.

પ્રદર્શન

અહીં ભૌતગણિતે આવેલ “Understanding Hinduism” પ્રદર્શન વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિનાં નૈતિક મૂલ્યો, બુદ્ધિમત્તા, માન્યતાઓની યાત્રા કરાવે છે. વળી, ૧૧ મિનિટનો વિડિયો શો આ મંદિર કઈ રીતે આકાર પામ્યું તેથી અને તેના નિર્માણ પાછળના હેતુની વિગતો છની કરે છે ત્યારે બાળકો સહિત વડીલો પણ વાહ પોકારી ઊઠે છે.



ગર્ભગૃહ – મુખ્ય મંદિર


પહેલા માળે મંદિરનો મુખ્ય ભાગ આવેલ છે. અહીં વિવિધ ભાતમાં કોતરાયેલ છતો, સ્તંભો અને મુખ્ય ઘુમ્મટ નિહાળતાં તો નેત્રો તૃપ્ત જ નથી થતાં. પથ્થરમાં આવી કોતરણી સહુને અચરજ પમાડે છે. સુવાર્ણમંડિત સાત સિંહાસનોમાં ભગવાનની મૂર્તિઓ કેંદ્રસ્થાને છે, જેમનાં દર્શન કરતાં હાથ સેલેજે જ પ્રાર્થના માટે જોડાય છે અને મન અકલ્પ્ય શાંતિ અનુભવે છે.

મંદિર શું છે?

મંદિર એ પ્રાર્થના માટેનું ઉત્તમ સ્થળ છે. સંસ્કૃતભાષામાં મંદિરનો સૌથી અર્થ છે – એવું સ્થળ જ્યાં મન સ્થિર થાય, આત્માને એવી મોકળાશ મળે જેથી તે જીવનનો અર્થ અને મર્મ સમજી ધન્ય થઈ શકે. મંદિર એટલે એક એવું કેંદ્રસ્થાન - જ્યાં લોકો ભગવાન અને સમાજની સેવા માટે એકત્ર થઈ શકે.

હવેલી પ્રાર્થના હોલ

૨,૭૫૦ ચોરસ મીટરમાં પથરાયેલું આ સ્તંભરહિત સભામંડપ એકસાથે ૨,૫૦૦ થી વધુ ભાવિકોને સમાવી શકે છે. અહીં અઠવાડિક સત્સંગસભા અને ઉત્સવસભાઓ યોજવામાં આવે છે. અહીં વાઈટિંગ સિસ્ટમ મહત્તમ વીજબચત થાય તે ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. અહીં ભેગા થયેલ માનવસમૂહ દ્વારા ફેંકાતી થર્મલ ઊર્જાનો ઉપયોગ પણ હીટ એક્સચેન્જર દ્વારા હવેલીના અન્ય ભાગોને ગરમી પૂરી પાડવા કરવામાં આવે છે. આમ, વાતાવરણને નુકશાન ન પહોંચે તેવી તકદારીઓ રખાઈ છે.



મૂર્તિ એટલે શું?

મૂર્તિ એટલે વૈદિકમંત્રો અને વિધિવિધાનો દ્વારા પ્રતિષ્ઠિત ભગવાનનું અર્થા સ્વરૂપ ! મૂર્તિ એટલે પથ્થરનું પૂતળું નહિ પણ સાક્ષાત્ ભગવાન – એવા ભાવથી અહીં મૂર્તિઓની સેવા-પૂજા-ભક્તિ ખૂબ સ્નેહપૂર્વક કરવામાં આવે છે. મૂર્તિ એ મંદિરનો આત્મા છે, અને મંદિર એ ભગવાનનું ઘર છે.



બુકસ્ટોલ

બુકસ્ટોલમાં તમે મેળવી શકો છો - અવનવા પુસ્તકો, પોસ્ટકાર્ડ, CD, DVD, આયુર્વેદિક દવાઓ, આપના સ્નેહીજનો માટે બજેટ અને પસંદગી પ્રમાણેની ભેટ-સોગાદો. આ વસ્તુઓ આપની મુલાકાતને ખરેખર અવિસ્મરણીય બનાવશે, માટે બુકસ્ટોલની મુલાકાત લેવાનું રખે ચૂકતા.

શાયોના રેસ્ટોરન્ટ અને વેચાણ કેન્દ્ર

અને હા, અહીં આવેલ શાકાહારી રેસ્ટોરન્ટમાં આપ જમવાની વ્યવસ્થા પણ માર્ણી શકો છો. પરંપરાગત ભારતીય સુશોભન અને મોંમાં પાણી છૂટે તેવું સ્વાદિષ્ટ, પૌષ્ટિક ભારતીય ભોજન આપને અસલ ભારતીય આસ્વાદનો અનુભવ કરાવશે. નજીકના વેચાણકેંદ્રથી આપ ભારતીય વાનગીઓ, વાસણો અને નાસ્તો પણ ખરીદી શકો છો.



બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર નિસ્ડન, લંડન


મંદિર દરેક ભાવિકો માટે ખુલ્લું મુકાયું છે અને પ્રવેશ માટે કોઈ ફી રાખેલ નથી.

મુલાકાતીઓ માટે સૂચના

- 📍 પહેરવેશ: ઢીંચણથી નીચે સુધીનાં વસ્ત્રો પહેરીને પ્રવેશ શક્ય બની શકશે, ટૂંકા વસ્ત્રો પ્રવેશમાં બાંધક બનશે.
- 📄 ધૂમ્રપાન: મંદિર પરિસરમાં મનાઈ છે.
- 📷 વિડિયો અને ફોટોગ્રાફી: આપ વ્યક્તિગત ઉપયોગ માટે મંદિરના ભોંયતળિયેથી મંદિરના બાહ્ય ભાગ અને હવેલીના ફોટોગ્રાફ અને વિડિયો લઈ શકો છો.
- 🚫 મોબાઈલ ફોન: મંદિર પરિસરમાં સ્વીચ ઓફ રાખવા વિનંતી.
- 🅑 પાર્કિંગ: નિ:શુલ્ક
- 🏠 શાળા અને ગ્રુપ મુલાકાત: આગોતરું બુકિંગ કરાવવું જરૂરી છે. તે માટે booking@londonmandir.baps.org પર સંપર્ક કરવો.
- 🚫 આહાર અને પીણાં: કોઈ પણ પ્રકારની ખાણીપીણી કે ચ્યુઈંગ ગમ મંદિર પરિસરમાં નિષિદ્ધ છે.
- 👁️ પ્રદર્શન અને વિડિયો: વડીલો માટે ૨ પાઉન્ડ અને બાળકો (૬ થી ૧૬ વર્ષ) માટે ૧.૫ પાઉન્ડ. શાળાઓ અને ગ્રુપ મુલાકાત માટે રાહત દરની સુવિધા છે. તે માટે booking@londonmandir.baps.org પર સંપર્ક કરવો.
- 🚶 અન્ય સુવિધાઓ: ઓડિયો માર્ગદર્શિત યાત્રા, લિફ્ટ, વ્હીલચેર, બાળકોનાં વસ્ત્રો બદલવા માટેની સવલત.
- 📅 માહિતી: પ્રવેશ, સમય અને સુવિધાઓની આગોતરી જાણ વગર તેમાં ફેરફાર થઈ શકે છે. વધુ અને તાજી માહિતી માટે જુઓ londonmandir.baps.org.
- 🕒 મુલાકાતનો સમય: દરરોજ સવારે ૯ થી સાંજે ૬ ભગવાનનાં દર્શન: દરરોજ સવારે ૯ થી ૧૨, સાંજે ૪ થી ૬ મધ્યાહન આરતી: દરરોજ બપોરે ૧૧.૪૫ વાગે મંદિરની સર્વાંગી મુલાકાત માટે ઓછામાં ઓછો સમય: ૨ કલાક

મંદિરે પહોંચવા માટે

- ✦ West End થી આશરે ૩૦ મિનિટ. A406 પર "Neasden Temple" તરફ સાર્થનપોસ્ટ આપેલ છે
- ✦ Overground/Bakerloo લાઈનથી Stonebridge Park અને ત્યાંથી 112 નં. ની બસ દ્વારા
- ✦ Overground/Bakerloo લાઈનથી Harlesden અને ત્યાંથી 206 અથવા 224 નં. ની બસ દ્વારા
- ✦ Metropolitan/Jubilee લાઈનથી Wembley Park અને ત્યાંથી 206 નં. ની બસ દ્વારા
- ✦ Jubilee Line થી Neasden, ત્યાંથી મંદિરે ફક્ત 20 મિનિટમાં ચાલનાં પહોંચી શકાય છે
- ✦ Baker Street થી 18 નં. ની બસ દ્વારા
- ✦ Brent Cross અને Ealing Broadway થી 112 નં. ની બસ દ્વારા



BAPS Shri Swaminarayan Mandir

105-119 Brentfield Road, Neasden, London NW10 8LD

☎ +44 (0)20 8965 2651 | ✉ info@londonmandir.baps.org

🏠 londonmandir.baps.org | 🐦 @NeasdenTemple | 📷 neasdentemple

© BAPS Swaminarayan Sanstha, UK: Charity No. 1143083 | CLG No. 7315272

